

# પહેલા મધુમેહ ને કાબુમાં લો નહી તો એ તમને કાબુમાં લેશે

મધુમેહને કિડનીની બિમારી એક  
એક સામાન્ય દિવસ, એક સામાન્ય જુંદગી



## ડાયાબીટીસ અને કિડનીને લગતા દરદો

સામાન્ય દિવસ, સામાન્ય જુંદગી  
બને અંદકાર મય,  
પડે ઈન્સ્યુલીન ની  
અછત રૂપે જો વીજળી.

## ડાયાબીટીસ કઈ બલા છે ?

મધુમેહ શરીરની ચચાપચચમાં ઉદભવતી એક એવી ખોડ છે. જેમાં શરીરમાં ઈન્સ્યુલીન નામના હોર્મોનનું ઉત્પાદન થતું નથી અથવા તો જરૂરી માત્રામાં તેનું શોષણા થતું નથી. ઈન્સ્યુલીન આપણા ખોરાકમાં લેવાતી સાકરનું નીંયંત્રણ કરે છે જે ન થાય તો લોહીમાં સાકરનું પ્રમાણ વધી જાય છે. આ બીમારી ડાયાબીટીસના નામે ઓળખાય છે, જેને કારણો (મધુમેહ) શરીરના ઘણા અવયવો ને નુકસાન પહોંચે છે. કિડનીની બિમારીનું આ એક મુખ્ય કારણ છે.

## (મધુમેહ) ડાયાબીટીસના પ્રકાર :

સામાન્ય રીતે ડાયાબીટીસ બે પ્રકારના હોય છે.

1) ટાઇપ I    2) ટાઇપ II

ટાઇપ I - મધુમેહનો આ પ્રકાર સામાન્ય રીતે બાળકોમાં જોવામાં આવે છે જેને “જુવેનાઇલ ઓનસેટ ડાયાબીટીસ મેલીટસ” કહેવામાં આવે છે. આ પ્રકારની બીમારીમાં દરદીના શરીરમાં પેનકીઆસ દ્વારા ઈન્સ્યુલીન નામના ર્સાયએટિક તત્ત્વનું ઉત્પાદન પુરતા પ્રમાણમાં થતું નથી. તેને સરબર કરવા માટે દરદીએ ડોક્ટરની સલાહ અને દેખરેખ હેઠળ યોગ્ય માત્રામાં ઈન્સ્યુલીનના ઈન્જેક્શન લેવા પડે છે. આ પ્રકારના દરદીઓએ ઈન્સ્યુલીન પર નીરભર રહેવું પડતું હોવાથી તેઓને “ઈન્સ્યુલીન ડીપેંડન્ટ” કહેવામાં આવે છે.

## પ્રકાર 2 - ટાઇપ - II

મધુમેહના ડાયાબીટીસના આ પ્રકારના વધારે દરદીઓ જોવા મળે છે. મોટા ભાગે આ 40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ થતો હોય છે માટે તેને “એડલ્ટ ઓનસેટ ડાયાબીટીસ

મેલીટસ” કહેવાય છે. આ પ્રકારના દરદીઓમાં પેનકિયાસ દ્વારા ઈન્સુલીન બનતું તો હોચ છે પણ તેમનું શરીર પુરતા પ્રમાણમાં તેનો ઉપયોગ કરી શકતું નથી માટે તેમને ગોળીઓ અને આહારમાં ચરી પાળી લોહીમાંના સાકરના પ્રમાણનું નીચેંત્રણ કરવું પડે છે. તેથી કરીને આ પ્રકારના દરદીઓ “નોન ઈન્સુલીન ડિપેંડન્ટ” કહેવાય છે. જો કે કેટલાક કિસ્સાઓમાં દરદીઓએ ઈનસ્યુલીનના ઈન્જેક્શન લેવા પડતા હોચ છે.

#### ડાયાબીટીસની શરીર પર પડતી અસરો

અનિયંત્રિત મધુમેહ શરીરના બધા ભાગોની રક્તવાહિનીને નુકશાન પહોંચાડે છે. એના કારણે લાંબા ગાળે શરીરના ફાન તંતુઓ, ચામડી, આંતરડા, શીરા, ઘમની કિડની, હૃદય, ઈંન્ડ્રીઓ, કોશિકાને નુકશાન પહોંચે છે. મધુમેહને કારણે ઊંચા લોહીના દબાણની બિમારી (B.P.) થઈ શકે છે. ઊંચા લોહીના દબાણથી હૃદય રોગ, ચામડીના રોગ, આંખના રોગ તથા નપુસંકતા જેવી બીમારીઓ આવી શકે છે. રક્ત વાહિનીઓને નુકશાન થતું હોવાથી કિડનીને પણ નુકશાન પહોંચી શકે છે. કિડનીની કાર્યશીલતામાં ઘટાડો થવાથી “ડાયાબીટીક કિડની” જેવા રોગો પણ થાય છે.

#### ડાયાબીટીસની કિડની પર થતી અસરો :

વષો સુધી ડાયાબીટીસની અસર રહેવાથી કિડનીમાં અશુદ્ધ લોહીને ગાળવાનું કામ કરતા નેફોન નામના કોષોમાં છાલા પડે છે તેથી તેમની લોહીને ગાળીને તેમાંથી અશુદ્ધિઓને દૂર કરવાની ક્ષમતા ઘટી જાય છે જેના કારણે શરીરમાં પાણી અને ક્ષારોનું પ્રમાણ વધી જાય છે. આના કારણે શરીરમાં સ્થુળતા, પગની ધુંટીઓમાં સોજ આવવા, મુત્રમાં પ્રોટીન (આલ્બ્યુમીન) આવવું વગેરે આડ અસરો થાય છે. દરદીને મુત્રત્યાગ કરવામાં મુશ્કેલી ઉલ્લિ થાય છે. મુત્રાશયમાં મુત્રનો ભરાવો થવાના કારણે મુત્રાશય ઉપર દબાણ વધે છે જે કિડની ને નુકસાન કરે છે. મુત્રાશયમાં મુત્રનો ભરાવો થવાના કારણે મુત્રમાર્ગમાં

બેકટેરીઆ વધુ ઝડપથી ઉદભવે છે અને મુત્રમાર્ગમાં ઈન્જેક્શન થાય છે.

#### ડાયાબીટીસના પહેલાના અને પછીના લક્ષણો

- મુત્રમાં પ્રોટીન / આલ્બ્યુમીન નુ જવું.
- ઉચ્ચ રક્ત ચાપ ઉચ્ચ લોહીનું દબાણ (B.P.)
- પગમા ને ઘૂટીમાં સૂજન ને ઝણઝણાટી
- વારંવાર મૂત્ર ત્યાગ માટે જવું, ખાસ કરીને રાત્રે
- લોહીમાં ચુરીઆ તથા કિએટીનીન નું પ્રમાણ વધવું.
- અચાનક ઈન્સુલીન અથવા ડાયાબીટીસ નિવારક ગોળીઓની જરૂરીચાત માં ઘટાડો થવો.
- માળ આવવી, ઉલ્ટીઓ થલી તથા બેચેની લાગવી.
- નબળાઈ આવવી, શરીર ફિક્ક પડવું તથા લોહીની કમી (એનેમીયા) થવી.
- શરીરમાં ખંજવાળ આવવી.

#### ડાયાબીટીસમાં કિડનીના રોગથી બચાવ

- ડાયાબીટીસને કાબુમાં રાખવાથી કિડનીના થતા રોગોતે અટકાવી શકાય છે.
- ઊંચા લોહીનું દબાણ (બ્લડ પ્રેસર) રક્ત ચાપ તથા મુત્રમાં વહેતા આલ્બ્યુમીનની નીચેમિત ચકાસણી કરાવવી.
- ડાયાબીટીસને લગતો યોગ્ય આહાર તથા શારીરીક કસરત કરવી.
- દારૂ, તથા ધુખ્યપાન તેમજ તમાકુના કોઈપણ પ્રકારના વ્યસનનો ત્યાગ કરવો.

#### કિડનીની કાર્યક્ષમતા ટકાવી રાખવાના ઉપાયો :

ડાયાબીટીસને કારણે થતી કિડનીની બીમારીનો કોઈ અક્સીર ઈલાજ ન હોવાછતાં પણ નીચે મુજબ કાળજી રાખવાથી તેની તિપ્રતાને કાબુમાં રાખી શકાય છે.

- 1) ડાયાબીટીસ તથા ઊંચા લોહીના દબાણ (બ્લડ પ્રેસર) ઉપર નીચેંત્રણ.
- 2) મુત્રમાર્ગમાં થતાં ઈન્જેક્શનની યોગ્ય સારવાર.
- 3) પથરી અથવા કિડનીની અન્ય બીમારીઓમાંથી યોગ્ય ઉપચાર દ્વારા મુક્તિ.

4) કિડનીમાં બગાડ થવાની શક્યતા વધારે તેવી દર્દશામક દવાઓ તેમજ આર્યુવેદિક દવાઓનો ઉપયોગ ટાળવો.

#### કિડનીને કેવી રીતે લાંબો સમય સારી રીતે સાચવી શકાય

- 1) કિડનીના તજજા (નેફોલોજીસ્ટ) પાસેથી કિડનીની પરીસ્થિતી જાણી તેનો ઉપયાર સુયાયે એ માટે તેમની સલાહ મુજબ યોગ્ય ઉપયાર પદ્ધતીનું ચુસ્તતા પુર્વક પાલન કરવું.
- 2) ડાયાબીટીક ખોરાકના સંયોજન દ્વારા લોહીના દબાણ (બ્લડપ્રેસર) ને નીચેંત્રણમાં રાખી ખોરાકમાં પ્રોટીન મર્યાદિત માત્રામાં લેવું.

#### ડાયાબીટીસના દર્દીઓ માટે ખોરાક

“ડાયાબીટીસની જાળ છે વિશાળ,  
નથી તેમાંથી છુટકારો આસાન,  
કરે ચમત્કાર કસરત અને આહાર  
જે ખોલે તમારી તંદુરસ્તિ ના દ્વાર”.

ડાયાબીટીસના ખાનપાનની આદતો, ખોરાકની માત્રા, સમયસર સંતુલીત આહારનું સેવન વગેરે દરદીએ જુદ્દો જુદ્દો ખોરાક જુદી જુદી માત્રામાં ખાપો જેથી સંતુલિત આહાર મળે. આ બાબતોનું ચુસ્તતપણે પાલન કરવું ખૂબજ આવશ્યક છે. સામાન્ય રીતે નીચે મુજબ કાળજી રાખવી જરૂરી છે.

#### સાકર તથા ગળયા પદાર્થોનું સેવન

ડાયાબીટીસના દર્દીને ગળપણ માટે સાકરનો ઉપયોગ ન કરતાં સાકરની અયેજુમાં સેકેરીન અથવા એસ્પરટેમ જેવા ફૂત્રીમ ગળયા પદાર્થો દા.ત. “સુગર ફી” “ઈકવલ” વગેરે વાપરી શકાય. આ જાતના પદાર્થો કેલરી રહીત હોય છે. ડોક્ટરે પ્રમાણિત કરેલી માત્રામાં તેનું સેવન કરવું. સગર્ભ સ્ત્રીઓ એ એનો ઉપયોગ ટાળવો.

#### ચરબી ચુક્ત સ્નીગ્ધ પદાર્થો :

ચરબીમાં અન્ય ખોરાકની સરખામણીમાં કેલરીની માત્રા વધુ હોય છે. એક ગ્રામ ચરબીમાં ૯ જેટલી કેલરી હોય છે.

ખોરાકમાં વધારે પ્રમાણમાં ચરબીનું સેવન ડાયાબીટીસ, હૃદયરોગ, ઊંચા લોહીનું દબાણ તથા સ્થુળતા લાપતા હોવાથી ચરબી ચુક્ત ખોરાક બની શકે તેટલો ઓછો લેવાય તે લાભદાયક છે.

#### નમક

સામાન્ય રીતે આપણા ખોરાકમાં નમકની માત્રા શરીરની જરૂરીયાત કરતા વધારે હોય છે. જે વ્યક્તિની પ્રકૃતી નમક પ્રત્યે સંવેદનશીલ હોય તેવાને વધુ પડતા નમકના સેવનથી ઊંચા લોહીના દબાણ (બ્લડપ્રેસર) બીમારી થાય છે. તેથી જ રસોઈ બનાવવામાં તથા ઉપરથી લેવામાં આવતા નમકનો વપરાશ ઓછો કરવો. ચાઈનીસ, ડબા બંધ ટીન પદાર્થ, બ્રેડ, બિસ્કિટના ખાદ્ય પદાર્થોમાં નમકનું પ્રમાણ વધુ હોય છે. બને તો તેનો ઉપયોગ ટાળવો. કિડનીના દર્દીઓ એ કાળા નમક (પોટેશયમ સોલ્ટ) નો ઉપયોગ કરવો નહીં.

#### રેશાવાળા ખાદ્ય પદાર્થો :

રેશા (ફાઈબર) આપણા શરીરમાં સાકર તથા ચરબીની માત્રાનું નીચેંત્રણ કરે છે. તેથી કરીને ખોરાકમાં રીફાઇન તથા પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરી કુદરતી સાકર ધરાવતા ખોરાક દા.ત. દાળ, મગ, ચાણા, સફેદ વટાણા, અકદ તથા રાજમા જેવા કઠોળ, ફળ ફળાઈ તથા રેશાવાળા શાકભાજુનો વપરાશ વધારવાથી ડાયાબીટીસ ઉપર નીચેંત્રણ મેળવી શકાય છે. મેંદો, બ્રેડ, બીસ્કીટ, કેક, ફરસાણ વગેરેનો ત્યાગ કરવો.

#### મધ્યપાન :

શરાબ અમુક માત્રામાં લાભદાયક હોવા છતાં તેના ગેરફાયદા વધુ હોવાથી તેનું સેવન ટાળવું હિતકારક છે. દાઢમાં રહેલી કેલરી અને રચના પ્રમાણે ભોજન લેવું જોઈએ. આપણા શરીરમાં દાઢનું ચરબીમાં ઝપાંતર થાય છે. દાડ દવારા લેવાતી કેલરીને સામાન્ય રીતે ખોરાકમાં લેવાતી કેલરી સાથે સંતુલીત કરીને લેવા. દાઢમાંથી કદ્ય પોષણ મળતું નથી કેલરી મળે છે. ૧ ગ્રામ દાઢમાં ૭ (સાત) કેલરી હોય છે દરદી ડાયાબિટિક હોય તો ખોરાકની સાથે

મદ્યપાન કરવું જેથી શરીરને ઓછું નુકસાન થાય. શરાબમાં શર્કરાનું પ્રમાણ વધુ હોવાથી ગળચા શરાબ અથવા તેના કોકટેલ (મીક્ષયર) નો વપરાશ ઓછો કરવો.

### ડાયાબીટીસમાં જરૂરી ભલામણો

- નીચમીત સમયે ખોજન કરવું.
- ઉપવાસ તથા મીજબાનીઓ પર નીચંત્રણા.
- રેશાવાળા અનાજ જેવા કે ઘઉં, જવ, જુવાર, બાજરો, રેશાવાળી દાળ, રાજમા, ચોળી, ચણા, મગ, મસુર વગેરેનો વપરાશ વધારવો.
- ડબ્બા બંધ તથા પોલિશ ખોરાક જેવા કે મેંદા, નુડલ્સ, પાસ્તા, ચીજ, માખણા, સાબૂદાણા, પાપડ, અથાણા, સોસ, બેકરી પદાર્થ, જ્યુસ, ઈરીટેડ ડિન્કસ, અને થીજલીને રાખેલા પદાર્થો જેવા કે માંસ પર નીચંત્રણા.
- ગલુકોઝ, સાકર, ગોળ, મધ, મીઠાઈ, ચોકલેટ થી બચવું એની અયેજુમાં કુશ્રીમ ગળપણાનો ઉપયોગ.
- મલાઈ વગરના ગાયના દૂધનો ઉપયોગ કરવો.
- ચરબી વિનાનો મર્યાદિત માંસાહાર, માઇલી, ઈંડાની સફેદી વગેરે કુક્કર વગેરેના માંસની બદલે લઈ શકાય (માંસાહારીઓ માટે).
- ખોરાકમાં સુપ તથા સલાડનું પ્રમાણ વધારવું.
- બટાકા, શક્કરીયા, સૂરણા, અળવી, ચીપ્સ, ફર્સાણા, વેફર, સેવ વગેરે નો ત્વાગ.
- કેળા, ચીકુ, દ્રાક્ષા, કેરી, સીતાફળ, સુકામેવા વગેરેની અયેજુમાં ખટાશવાળા તથા રેશાવાળા ફળો દા.ત. પેરુ, નાશપતિ, પફૈયા, સફરજન, અનાનસ, કલીંગર વગેરે ફળો લેવા.
- બિમારીની જાણ થતાની સાથેજ કસરત શરૂ કરવી જેવી કે, ઝડપથી ચાલવું, જોગિંગ, દોરડા ફૂદવા, એરોબિક્સ, સ્વિમ્બિંગ, ટેનિસ, ચોગા વગેરે, કેમકે સારા સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે.

### બામક માન્યતાઓ અને સચ્ચાઈ (હકીકત)

ખમ : ડાયાબીટીસથી મુક્ત થઈ શકાય છે.

સચ્ચાઈ : મધુમહથી ડાયાબીટીસ એક એવી બિમારી છે જે મટી શકતી નથી પણ તેને કાબુમાં રાખી શકાય છે.

ખમ : મધુમહથી, ડાયાબીટીસથી પીડાતી વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકતું નથી.

સચ્ચાઈ : ડાયાબીટીસ ઉપર નીચંત્રણા મેળવીને સંપુર્ણ રીતે સામાન્ય જીવન જીવી શકાય છે.

ખમ : ડાયાબીટીસ નો અંતીમ ઈલાજ ઈન્સ્યુલીન જ છે.

સચ્ચાઈ : એવું નથી ઈન્સ્યુલીનની જરૂરિયાત ડાયાબિટિશના પ્રકાર ઉપર નક્કી થાય છે. ડોક્ટર દ્રારા ઈન્સ્યુલીન ની ભલામણ કરવામાં આવી હોય તો તેને અવગણાવી નહીં.

ખમ : ડાયાબીટીસ કાબુ માં આવ્યા બાદ સારવાર બંધ કરી શકાય છે.

સચ્ચાઈ : ડોક્ટર સલાહ ન આપે ત્યાં સુધી ઈન્સ્યુલીન ની સારવાર બંધ કરવી નહીં.

ખમ : મધુમેહ ને લગતા સામાન્ય લક્ષણો ન જણાય તો ડાયાબીટીસ ન હોય.

સચ્ચાઈ : કોઈપણ જાતના બાહ્ય લક્ષણો ન હોવા છ્ટાં પણ અન્ય રીતે સ્વસ્થ દેખાતી વ્યક્તિ ડાયાબીટીસ પીડીત હોઈ શકે છે. લોહીમાં સાકરનું પ્રમાણ સામાન્ય હોવું તે એકજ ડાયાબીટીસ નીચંત્રણામાં હોવાની સાબીતી છે.

ખમ : એક વખત ઈન્સ્યુલીનના ઈન્જેક્શન શરૂ કર્યા બાદ આજીવન લેવું પડતું હોય છે.

સચ્ચાઈ : શરીરમાં ઈન્સ્યુલીન બનાવતી ગ્રંથી પેનકીયાસ ઈન્સ્યુલીન બનાવવાનું બંધ કરી દે ત્યારેજ ઈન્જેક્શન દ્રારા ઈન્સ્યુલીન લેવું પડતું હોય છે. ઈન્જેક્શન મારફત ઈન્સ્યુલીન લેવાથી પેન કીયાસને આરામ મળે છે અને કોઈક વખત અમુક સમય બાદ ઈન્સ્યુલીન બનાવવાની તેની ક્ષમતા પુનર્જીવીત થાય છે ત્યારે ડોક્ટર ની સલાહ મુજબ

દરદી ઈન્સુલીન ના ઈન્જેક્શન બંધ કરીને ફરીથી ગોળીની સારવાર શરૂ કરી શકે છે.

#### ડાયાબીટીસમાં ચાદ રાખવા ચોગ્ય ભલામણો:

- મધુમેહના દરદીએ લોહીમાં સાકરની માત્રાનું પ્રમાણ પ્રયત્નપૂર્વક કાબુમાં રાખવું જરૂરી છે.
- સમયસર નીચીત રીતે જરૂરી માત્રામાં ખોરાક લેવો.
- પગની ચોગ્ય માવજત રાખવી. બેદરકારીને કારણે પગમાં થતી ઈજા પગ કપાવવાની હદ સુધી પહોંચી શકે માટે તેમ ન થાય તેની ચોગ્ય સાર-સંભાળ રાખવી.
- ડોક્ટરની સલાહ વગર ઈન્સુલીન ની સારવાર બંધ ન કરવી.
- ડાયાબીટીસની વ્યાધીથી થતી આડ અસરોને નીવારી શકાતી નથી, માટે તેની આડઅસર ન થાય તેની સતત કાળજી લેવી.
- ઈન્સુલીન ઉપર નીર્ભર દરદીઓએ અન્ય બીમારીઓ ની સારવાર દરમીયાન ડોક્ટરની સલાહ સીવાય ઈન્સુલીનની સારવાર છોડવી નહીં.

#### ડાયાબીટીસ તથા ઉચ્ચ રક્તચાપ નીવારણ માટેના દસ નીચીતો :

- સ્થુળતા અટકાવવી.
- ડોક્ટરની દેખરેખ હેઠળ 130 / 80 (બી.પી.) લોહીનું દબાણ (બ્લડ પ્રેશર) જાળવી રાખવું.
- કિડનીમાં પથરી વગેરે બીમારીનું નીવારણ.
- અનાજ, કઠોળ, શાકભાજી, ફળ ફળાદી પ્રાકૃતીક રૂપમાં ખાવા.
- નીચીત કસરત કરવી.
- શારીરમાં સાકર નું પ્રમાણ જાળવવું.
- નીચીત રીતે દાકતરી તપાસ કરાવતા રહેવું.
- પાણી તથા ખોરાક દ્વારા ફેલાતા સંકમણ થી બચવું.
- દર્દ શાકમ તથા આર્ચ્યુવેદિક દવાઓના વપરાશ પર નીચેંત્રણા.
- કિડનીની બીમારી વારસાગત હોવાથી પરીવારના અન્ય સભ્યોની ડોક્ટરી તપાસ કરાવવી.



**મુંબઈ કીડની ફાઉન્ડેશન**  
લેન્સલોટ મેડીકલ સેન્ટર,  
111-સી, લેન્સલોટ, શાસ્ત્રીનગર સામે,  
બોરીવલી (પણ્ણિમ), મુંબઈ - 400 092.  
ફોન નં. : 2801 2783, 2801 6266, 2862 6854